

INVESTMENT & PRECISION CASTINGS LTD

You Design, We Cast

Corporate Identification No. (CIN): L27100GJ1975PLC002692

REGD. OFFICE NARI ROAD, BHAVNAGAR & WORKS GUJARAT, INDIA 364 006 TELEPHONE (91) (278) 252 3300 to 04 (91) 70695 80001 / 70695 80002

E-MAIL direct1@ipcl.in WEBSITE www.ipcl.in | NADCAP Approved for NDT EN 9100 : 2018 | IATF 16949 : 2016 | ISO 9001 : 2015 | ISO 14001 : 2015 | ES OHSAS 18001 : 2007 | NABL Accredited Lab

Certified Company

Date: 4th August,2023

The GENERAL MANAGER DEPARTMENT OF CORPORATE SERVICES

The Bombay Stock Exchange Limited 1st Floor, New Trading Ring, Rotunda Building P. J. Tower, Dalal Street, Fort Mumbai 400 001.

Dear Sir,

Sub: newspaper advertisement for Transfer of equity shares to IPEF

Ref: Scrip Code No. 504786.

In teams of regulation 30 read with schedule III Part A and regulation 47 of SEBI (LODR) regulations, 201 attached here copies of newspaper advertisement in The Economics time (English) and Navgujarat Samay (Gujarati) Published and sandesh (Gujarati) Published as on 4th August, 2023. Containing notice to share holders who have not claimed their dividend for seven or more consecutive years and whose shares are liable to be transfer to IPEF authority.

In pursuant to section 124(6) of companies act 2013and read with IPEF authority (accounting, audit, transfer and refund) rules, 2016 and amendments thereof. This information is also available at the website of company www.ipcl.in

This is for your information and record purpose

Thanking You

For Investment & Precision Castings Limited

Mr. PRATAPKUMAR PANDURANGARAO BOLISETTY

Whole Time Director

DIN: 08065764

Services Activity Hits 13-year High in July

New orders come from Bangladesh, Lanka, Nepal, UAE

New Delhi: Services activity in the country reached its highestlevelin18 years in July, buoyed by a pick-up in both do-mestic and international demestic and international de-imand. The sessonally adjus-led S&P Global India Services Post Services and the services Post to 62.3 last month from 28.5 in June, the rating andre-seauch agency said in a report released on Thursday. A value of over50 denotesex-pansian. A number below 50 Endicatescontraction.

Parasian. A number below of and locates contraction. The resilience of the service Sector underscores its vital role in the link light in seconomy, with the PMI results for July so far pointing to a notable count induction from the sector overall GDP for the second also and the sector of the property of the property

To overall GDP for the second ifical quarter, said Pollyama De Lima, economic associate chrector at SeP Global Market Intelligence.

"The broad increases in sales across the demestic and international markets are particularly and intelligence of the seconomic across epical polyama and intelligence."

In a seconomic across epical polyama properties and international markets are particularly across the comment of the seconomic seconom

prio," she added.
Service orders rose at the sec-ond fastest pace since Septem-ber 2014, with demand coming from Bangladesh, Sri Lanka, Nepal and the UAE.



Experts have been highlight ing the role of strengthening service activity in India's consumption demand and rising GST collection.

"The gap hostwoen the service of PMI GST, Nuch has been failing in the past two menths, widened again," said Raid and Bajoria, managing director and head of EM Asia (es. China) economics at Berdays, "Overall weeppet services anchor growth this year," he added.

Allbough the 400 service firms surveyed by SEP indicated a softening of future outbook compared to June owing to extreme weathercorditions they cited demand strength and marketing initiatives as reasons for optimising for the year,

the S&P report said.

Employment performance was muted in July with the increases broadly in line with the previous two months.

On the inflation front, services sector companies faced further and the previous two months are sector companies faced further as they re-

On the inflation front, service sector companies facel further cost pressures as they record or cost provided greater food, labour and transportation costs comributing to inflation raising at fastest pace in 13 months.

"Although input cost inflation ticked higher in July, service providers were again eautions in their price setting decisions amid efforts to not detersales." De Lima said. Impatinflation rose fastes for consumer services whereas output prices, which is charged to the consumer, witnessed faseig growth in treal estate and

the consumer, witnessed fas-st growth in real estate and

Finance and insurance was July's best performer among services sectors measured by S&P.



PAR DRUGS AND CHEMICALS LIMITED CIN: L24117GJ1999PLC035512

Registered office: 815, Nilamber Triumph, Gotri Vasna Road,

Vadodara-390007, Gujarat, India

Phone no: 0265-2991021, 0265-2991022
Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

Statement of Standalone Unaudited Financial Result for the Quarter Ended 30th June, 2023

SI.	Share the top -		Quarter Ended		Year Ended
No.	Particulars	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	2294.68	2452.31	2365.98	9598.71
2	Net Profit / (Loss) for the period (before Tax. Exceptional and/or Extraordinary items*)	329.74	453,94	306.56	1507.92
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items*)	329.74	453.94	306.56	1507.92
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items*)	246.75	344.69	229.40	1133.41
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	246.75	344.69	229.40	1133.41
6	Equity Share Capital (Face Value per share Rs. 10/-)	1230.46	1230.46	1230.46	1230.46
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.				5893.37
8	Earnings Per Share of Rs. 10/- Each Basic as well as Diluted	2.01	2.80	1.86	9.21

Note: (a) The result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective moeting held on 03/08/2023. (b) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Result for the Quarter ended 30th June, 2023 filed with the National Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended 30th June, 2023 are available on the website viz https://www.nspindia.com/ and the website of the Company at www.pardruge.com (c) # Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules/AS Rules, whichever is applicable.(d) The Company is primarily engaged in manufacturing of API, which constitute single business segment in terms of Ind AS - 108 on 'Operating Segments'. Accordingly, there is no separate reportable segments as per Ind AS - 108.

Date: 03/08/2023

For & on Behalf of the Board Par Drugs And Chemicals Limited Sd/-Mr. Falgun V. Savani (Chairman & Managing Director) (DIN: 00198236)

(B) Investment & Precision Castings Ltd

Brojdowd Office - Nain Rasi, Bruwagar, Gujart 684 006 India OMPOPANTE ICENTITY NAMERIA (Ruy). L271006-1913FR-L000398 Provi. : 30) (270) [22 000 to 94.

E-mail: giasti 1 3poil: messigne Ispoil: White Ispoil: White

contractions of the second sec

company has already sent inflination to each shareholder ind it available actions. Whose shares are liable to transfer to IEPF Aut or this rule Requesting them to take needful actions on or beforement, 2023 betalle of such shareholder what he also available at www.pd.in

For INVESTMENT & PRECISION C

Mr. Piyush I. Tamboli CHARMAN & MANAGING DIRECTO

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST FOR [REAL VALUE PROMOTERS PRIVATE LIMITED] OPERATING IN [REAL ESTATE ACTIVITIES] AT [CHENNAI DISTRICT] (Under Regulation 36A(1) of the leadwiney and Barierspey Board of India (Insidering Regulation 7688) for Compared Foruson's Regulations, 2016)

	RELEV	ANT PARTICULARS
1	Name of the corporate debror along with PAN / GIN / LLP No.	MIS.REAL VALUE PROMOTERS PRIVATE LIMITED PRINACH49878/ CIN:U701011N1995PTC032587
2	Address of the registered office	Ambojini, No. 17, Poss Road, Il Street, Toynampet, Chennai - 500018
3	URL of website	http://www.rsalvaue.in/
4	Details of clace where majority	of fixed assets are located

Patmalaya Apartments - Sruser Man Road, 6 Block, Chernai, Taminatu 608103 983103 Mellerand, Part Street, Kaztigottur, Taminadu – 613103 Palsarani Lanti – 200 R. vide Palsarani Thurapaktori, Ratisi King Road Survey Mc - 33, 35, 5171, 5174, 5175, 5175, 5175, 5176 in Nemickey Vilago, Thurabaran blak, Kaneliguran Distret Chemal, Taminadu Armansi Bulking – 455 Anto Stata, v Teymurpet, Chemal, Taminadu–800018 Izon detali as u bertativo & miriti Mir furbiro detala;

Native deals as bistance A refer Mr for farine details.

Hete: The Coprobable Death is also by securided and exposured invocable Construction Agreement (southerwith invocable ingistered Prove of Abstrance; both oated Experience (2011; in feveral of Feel Wake Nethrose Problect Limiter (PVMF 449), pursuant to which RVMP, has invocable and esclisake Divideoprame Flights including all order. Interest. extrements, publishes and herefilm in the land measuring specificarille; 17.28 acres outside all Pollowson and Normitchery Wilages, Chemisticoccilings, entre excensive and reference of the composition of the control of the composition of t The Company's major revenue is f

5	products / services	construction of apartments & rental income.
6	Quantity and value of main products / services sold in last francial year	As per Audited Financials, turn over from operations for the FY 2021-2022 is Rs.6.67,31,000
7	Humber of employees / workmen	19 Employees (approx.)
8	Further details including last available financial statements (with schedules) of two years, lasts of oreditors, relevant dates for subsequent events of the process are available at.	Can be collected from the office of RP Mis. SPP insolvercy Professionals LLF No.27/9, Mived Wass, Pankala Mill Road, Pulnakulam, Colinbatore- 641045 Ph.No. :73750 52341 / 94868 10404
9	Eligibility for rescription applicants under section 25(2)(h) of the Code is available at:	[Email to: maunishkumar@ical.org / rvspl.cip@gmail.com]
10	Last data for receipt of expression of interest	26th August, 2023
11	Date of issue of provisional list of prospective resolution applicants	30th August, 2023
12	Last date for submission of objectors to provisional list	04th September, 2023
13	Process erral id to submit EUI	msurestkurrer@ca.org / rvppl.drp@gnai.com
	te : 04th August, 2023 cc: Chonna	(CA Matalingam Survet Kurrar) Name and Signature of Resolution Protessional Reg.No18B/IPA-001/P-P00110/2017-18/10217

GREEN ENERGY NURTURING ENVIRONMENT GUJARAT GAS More than 2.61 mmscmd -800* Highest ever CNG **CNG Stations** Volume in Q1 Commissioned Approx. More than 3.75 Lakhs 19 Lakhs*Domestic Vehicle fueled Customers Commissioned per day

	STATEMENT OF UNAUDITED FINANCI	AL RESULTS FOR	THE QUARTE	R ENDED ON	30™ JUNE 202	23	(₹ in Crores
			Standalone			Consolidated	
Sr. No.	A40.0000	Quarter	ended	Year ended	Quarte	ended	Year ended
No.	Particulars	30-05-2023	30-06-2022	31-03-2023	30-06-2023	30-06-2022	31-03-2023
		Un-au	dited	Audited	Un-au	dited	Audited
1	Total income from operations	3,947.55	5,322.20	17,407.43	3,947.55	5,322.23	17,407.49
2	Net Profit for the period (before Tsx, Exceptional items)	289.36	508.85	2,024.65	289.36	508.88	2,024.71
3	Net Profit for the period before Tax (after Exceptional items)	289.36	508.65	2,024.65	289.36	508.88	2,024.71
4	Net Profit for the period after Tax (after Exceptional items)	215.09	381.10	1,525.47	215.95	381.90	1,528.38
5	Total Comprehensive income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	216.14	383.34	1,533.99	216.97	384.15	1,536.74
6	Equity Share Capital (Face value of ₹ 2/- each)	137.68	137.68	137.68	137.68	137.68	137.68
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)			6,857.93			6,890.27
8	Earnings Per Share in ₹ (Face Value of ₹2/- each) (not annualised for quarter)	3.12	5,54	22.16	3.14	5.55	22.20
	Basic (₹) Diluted (₹)	3.12	5.54	22.16	3.14	5.55	22.20 22.20

- The financial statements have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 and read together with the Companies (Indian Accounting Standards Ind AS) Rules issued thereafter another accounting principles generally accepted in India. These financial results are presented in accordance with the requirements (Regulation 30 of the SEEII (Listing Dissipations and Disclosur-Regulations, 2015 as amended from Intentionis analong with other relativant fuels issued the resulted.

 The above its an extract for the desilect forms of quarterly Financial Results list of the his block Exchanges under Regulations, 2015 as amended). The International Results list of the SEEII (Listing 2004) and the Regulation SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004). The SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004) and the Regulation SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004). The SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004) and the Regulation SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004). The SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004) and the Regulation SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing 2004). The SEEII (Listing 2004) are applied to the Regulation SEEII (Listing

The above firancial results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Tricolos at its meeting held on 2" August, 2023 at Gandhinagar, Gujarat. Previous particular have been reclassifed / regrouped wherevercentidened necessary to conform to the current period figures.

For and on behalf of Board of Directors Gujarat Gas Limited

Milind Torawane, IAS Managing Director

Place: Gandhinagar Date: 2" August, 2023 **GUJARAT GAS LIMITED**

વેપારીની આત્મહત્યાનું કારણ અકબંધઃ પોલીસ તપાસ શરૂ સાબરમતીમાં ડુબી

હિંમતનગરમાં વેપારીએ ગળા પર ચપ્પુના ઘા મારી મોતને વ્હાલું કર્યું

હિંમતનગરની મધુવન સોસાયટીમાં રહેતા એક વેપારીએ કોઇ અગવ્ય કારણોસર પોતાની જાતે જ ગળાના ભાગે ચપ્પાના ઘા મારી મોતને વ્હાલું કર્યું હતું. ઘરના અંદરના દરવાજાઓ બંધ કરીને મોતને ભેટનાર વેપારીની લોહીલુહાન્ન હાલતમાં લારા મળી આવતાં હિંમતનગર એ ડિવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસ હાય થયા છે. આ ગંગે પોલીસ સુત્રીમાંથી મળતી પાકિતી અનુસાર મયુવન સોસાપદીમાં રહેતા ચિંતનભાઈ હસમુખલાલ સોની (ઉ.વ.૩૮) બુધવારે રુપિના સુમારે પોતાની જાતે ઘરનો અંદરનો દરવાજી બંધ કરીને ઘરમાં કંઇ અગમ્ય પાસ્ત્રોજી પોતાની જાતે ગામાન લાગે ધરભોગર પોતાની જાતે ગળાના ભાગે પ્યાના ધા મારીને મોતને વ્હાલુ કર્યું હત. પટનાની જાજ થતાં આસપાસના હોડોએ હિંમતનગર એ ડિગીઝન પોલીસને જાણ કરતા એ ડિગીઝન નોગાઇ બીવી લેવિયા તથા તેમની ગળાના ભાગે ગુપ્લાના છા માટી

ારીજ વસ્તુની કોસ્ટ મેનેજમેન્ટ આગામી દિવસમાં ખૂબ મહત્વની બાબત

બનશે, તેવું સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિત્યકર્માએ ઉદયભાવસિંહજી વેત્રીય

સહકાર મળંવ સંસ્થાન, સેક્ટર- ૩૦ ખાતે ૧૬મી પીજીડીએમ એબીએમની બેચના

ઉદ્ધારન સમારભમાં જણાવ્યું હતું. તેમલે વધુમાં જણાવ્યું હતું કે, એકકિલો વર્લ – યોખા ઉચાડવામાં કેટલું પાણી જરૂરી

છે, કેવી રીતે ઓછ પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે સાર્યું ડ્રીય ઇરીગેશન

મેનેજમેન્ટ હવે, પછીના સમયમાં જરૂરી બનશે પ્રાકૃતિક ખેતીની વાત કરતાં તેમલે ઉમેર્યું હતું કે, વિશ્વમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની માંગ વધી રહી છે. ગુજરાતમાં

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારત દેશની મહિલાઓ ધરનું મેનેજમેન્ટ ખૂબ જ ઉમદા રીતે કરે છે, તેવું કહી તેમણે ઉમર્યું

છત્રાલ પાસે કારમાંથી

લાખનો મુદ્દામાલ જપ્ત

■ક્રવોલ તાલુકાના છત્રાલ નજીકથી પસાર થતી ડારમાંથી એલત્રીબીની ટીમે ઘરૂના જથ્થા સહિત 1,20 લાખનો

ની ટીમ નાઈટ પેટોલીંગમાં હતી. ત્યારે

બાત મી મળી હતી કે, નંબર પ્લેટ વિનાની એક સિલ્વર કલરની કરમાં વિદેશી ઘર્

એક તાલ્લાદ કવાનો છે. દરમિયાન બાતમી સાથે પસાર થવાની છે. દરમિયાન બાતમી મુજબની કર આવતા ઉભી રાખવા માટે પોલીસે બેટરીથી ઇશારો કર્યો હતો. પરંતુ

ચાલકે કાર રોડની બાજુની જવ્યામાં થઈ

ડલોલ તરફ ભગાડી મુડી હતી. જેથી પોલીને પીછો કર્યો હતો. ગેટલે ગાલકે પ્રિંદભદ થઈ ઓળડકર લિજ ઉત્તરતા રોડ

વચ્ચેનો ડિવાઇડર કુદાવી રૉગ સાઈડમાં કાર કુસાઉ દીપીને ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. કારની તલાશી વેતાં 29 હજારની કિંમતનો દારૂ વળી આવ્યો હતો. દહેગામમાં હિટ એન્ડ

रन . કારની ટક્કરથી

પુષ્કર જ્યુપિટર લઈને દહેગામ લેલેજથી નેહ્યુ લોકડી તરફ જઈ રહ્યો હતો. સામેની

ુનક્યું હોકડી વરફ જેઇ રહ્યાં હતા. સામની બાજુએ પૂરપાટ ઝડખે હોર વિહાર આવી કહ્યું હતું. હારના ચાલકે જ્યુપિટરને ટક્કર મરતાં પુષ્ક નીચે પટકાયો હતો. અકસ્માત સર્જીને કારચાલક કચર થઇ ખૂબો હતો. સ્થાનિકોએ 108ની મદદથી તેને દહેપામ સામૃદ્ધિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોક્ક્સ્સ હતો. જ્યાંથી હોને કાઇનાડા ક્યિક્ક અને હતા. જ્યાંથી હોને કાઇનાડા ક્યિક્ક અને હતા. જ્યાંથી

તેને ગાંધીનગર ત્રિદિલ અને બાદમાં

અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો.

અમદાવાદ સિવિલમાં પુષ્કરના ગળાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું છે, પદ્મ

હજુ તેની હાલત ગંભીર છે.

મુદ્દામાલ ઝડપી પાલ્યો હતો ગાંધીનગર લોકલ કાઇમ શ્રાંચ

નવગુજરાત સમય > ગાંધીનગર

धाउँ सहित 1.29





રરના જાતા ચિંતનભાઇ હસમુખવાલ સોનીની લોહીલુડાગ્ર ડાલતમાં લાશ થવી આવી હતી. જે સંગેની જાણ થતાં નરોડ લતા. જ અંગના જાલ થતા નવાડ ખાતે રહેતા તેમના ભાઈ અંજુલકુમાર હસત્રુખલાલ સોની હિંમતનગર દોડી આવ્યા હતા અને ક્યાં કારણોસર ચિંતનભાઇ હસમુખલાલ સોનીએ

હતું કે, કોરોના જેવી મહાબિમારી પણ મોટા

ભાગના પરિવારો પોતાની બચત કરવાની ાવના કારણે ટકી શક્યા છે. સામ

રીતે ભારત દેશના પરિવારમાં એક વ્યક્તિ

કમાયછે. જયારે વિદેશમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ પરિવારના સભ્યો કમાય

છે. આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર ડો એ.કે. અશ્વાનાએ સર્વે મહાનુભાવો અને

વિધાર્થીઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, સંસ્થાના સ્થાપના પાછળના ઉમદાત્માવથી સર્વે વિધાર્થીઓને વાકેક કર્યાં હતા. તેમજ

સંસ્થામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોર્ન માહિતી આપી હતી. કાર્યક્રમના અંત

પીજીડીએમ એબીએમના ડારેક્ટર નિલ્ પઉ આભારવિથી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડાયરેક્ટરના

માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઓફિસ સુપ્રિડેન્ટ જવેરાભાઇ ત્રિવેદ્રી, લાયબ્રેરિયન

અલ્પેશ જોપી સહિત સંસ્થાના સ્ટાર પરિવારે જહેમત ઉઠાવી હતી,

દીવમાં ઇન્ડિયન પાસપોર્ટ ગુમ થયેલ છે.

હું તેજલ મોહન રહે. નાગવા (દીવ) માં હું રહું છું નાગવા

થી દીવ આવતા માર્ં ઇન્ડિયન

પાસપોર્ટ નં.V1483246

તેજલ મોહન

42 -t:- 3349

ગુમ થયેલ છે.

જગદીશ વિશ્વકર્માના હસ્તે પીજીડીએમ એબીએમની બેચનું ઉદ્ઘાટન ચીજ- વસ્તુનું કોસ્ટ મેનેજમેન્ટ આગામી

સમયમાં મહત્વનું: સહકાર રાજય મંત્રી

આત્મહત્યા કરી છે તે અંગે યોલીસે દોડી હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી હતા તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર મૃતકે ધરના અંદરના દરવાજાને બંધ કરી રાખ્યા હતા. ક્યા કારણોસર આવુ ફૃત્ય કર્યુ છે તે અંગે પદ્મ પોલીસ આસપાસમાં રહેતા લોકોનો ચંપર્ક કરી જાણકારી મેળવી રહી છે. આર્ધિક સંકડામજ કે, શારિરીક તકલીફ કે અન્ય કોઇ કારલોસર પોતાની જાતે ચપ્પાના પા મારી વેપારીએ જીવન ટુંકાવ્યુ છે ત્યારે આસપાસના લોકોમાં શોકની લાગણી

ગયેલા સાદરાના યુવાનની લાશ ત્રીજા દિવસે મળી

પ્રવાહ વધુ હોવાથી લાશ તણાઈને સંત સરોવર સુધી પહોંચી ગઇ હતી.

વરોઈ ડેવમાંથી પાજી છોડવામાં આવ્યું

Registered Office - Nan Food, Bravingar, Gulanti 36s 006, India CCRPCRATE IDENTITY NUMBER (CN); 12/1906.JIS/SPLC602653 Prone: (51) 12/81 262 300 to 04, E-mait cirect! Glod.ii, Investor Glod.ii Webster www.lpclin NOTICE

સાબરમની નદીમાં મંગળવારે ડુબી ગયેલા સાદર ગામના યુવાનની કાશ ભારે શોષબોળ બાદ ગુરુવારે ત્રીજા દિવસે મળી આવી હતી, ઉપરવાસમાં ભારે વરસાદના કારલે નદીમાં પાલીનો

ગાદરા ગામનો દિનેશ રતાજી ઠાકોર (इ. 33) अने तेनो भित्र खूपत क्षड़ीर મંગળવાર સવારે વાંસ કાપવા માટે સાબરમતી નદીનાં સામે કિનારે ગયા હતા. તે વખતે એકાએક દિનેશ નદીના ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. ગાંધીનગર ક્ષયર બ્રિગેડે કલાકો સુધી દિનેશની શોધખોય આદરી હતી. જો કે હોવાથી દિનેશનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો,દરમિયાન ગાંધીનગર કાયર બ્રિગેડના ગ્રબ ક્ષ્યર ઓક્સિર મહિતની ટીમે સતત ત્રસ દિવસ સુધી સાબરમતી નદીમાં સર્ચ ઓપરેરાન ચાલુ રાખ્યું હતું. ત્યારે આજે સવારે લાશ સંત સરોવર સુધી લાશ તલાઈને આવતા કાયર બ્રિગેડે બહાર કાઢી હતી અને તે અંગે પોલીસને अध की उनी

Druestment & Precision Castings Ltd

Transfer of Equity shares and unpaid/unclaimed dividend of company to Investor Education and Protection Fund (IEPF)

કલોલ રેલવે સ્ટેશનનું 40 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

ાલમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 508 રેલવે સ્ટેશન સાથે ગાંધીનગર જિલ્લાના ક્લોલ રેલવે સ્ટેશનનું પણ રૂ.4) કરોડના ખર્ચે રિનોવેશન કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તે માટે રવિવારે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરાશે. તે પછી હાથ પરવામાં આવનારા વિકાસ કામ બાદ કલોલ રાહેરના

સાથે સ્ટેશનને ઝળલગતુ કરવામાં આવશે. આ એંગે રેલવે બોર્ડ ક્ષસ જણાવાયા મુજબ વિગત એવી છે કે ભારત સરકાર કારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના વિવિધ 580 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનું અભિયાન કાથ ધરવામાં બાવ્યુ છે. તેના ભાગરૂપે શિક્ષાન્યાસનો કાર્યક્રમ તા. દ ઓગસ્ટને રવિવારે સવારે ૯ વાગ્યે યોજવામાં આવ્યો છે. ત્યારે પ્રાયનમંત્રી નરેન્દ્ર મોદીના વરદહરતે વીડિયો કોન્ફરન્સ

દ્રારા ખત્મકુર્ત કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનોમાં કલોલ રેલવે સ્ટેશનનો પણ સમારેશ કરવામાં આવ્યો છે. રૂ. 40 કલેડના ખર્ચ આ સ્ટેશનની ક્રયાપલટ કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રસંગે કલોલના પારાસભ્ય લમ્પલ્રજી (બકાજી) હાર્યર રહિત ગાંપીનગર જિલ્લા અને સાલરમતી વિસ્તારના ધારાસભ્ય સહિત કુલ છ ધારાસભ્યો હાળરી આપશે. તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, રેલવે સ્ટાક ઉપરાંત કલોલ શહેર અને તાલુકા પંયકના આગેવાનો હાજર રહશે,



EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30™ JUNE, 2023

						3	₹ in Lakhs)
			Standalone			Consolidate	d
Sr. No.	Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended	Quarter Ended	Year Ended	Quarter Ended
		30.06.2023	31.03.2023	30.06.2022	30.06.2023	31.03.2023	30.06.2022
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited
1	Total Income from Operations	42719.02	179619.15	39575,07	4289070	180350.24	39720.3
2	the Profit / (Loss) for the period (before Tax, Exceptions and / or Extraordinary items)	7521.47	28672.57	529613	760236	200000.02	535065
3	Exceptional item	8	600.00			(600.00)	
4	her Profit / (Lass) for the period before Tax (after Exceptional and / or Extreordinary items)	7524.57	28172.57	529613	760236	28488.52	5359.68
5	Ner Profit / (Leas) for the period after Tax (after Exceptional and / or Extraordinary fams)	5837.49	2006558	3963.22	S670.16	21105.00	1986.50
6	Total Comprehensive Income for the period [Comprising ProfitStoss for the period (after tax)] and Other Comprehensive Income (after tax)]	5618.78	2089903	3940,77	565171	21039.56	3964.27
7	Equity Share Cepital (Fince value of Rs. 5/- each)	650.29	650.29	650.29	65029	650.29	650.29
8	Other Equity Excluding revaluation reserve) as shown in the Auditor Balance Sheet of the previous year		11627125			116613.48	
	Earnings per equity share (of Rs. 5/- each) (EPS for the quarter not annualised):						
9	() Basic (f)	43.35	16120	30.47	4327	161,01	30.36
	(2) Diluted (1)	43.35	36120	30.47	13.27	161.01	30.30

- The above is an Extract of the detailed format of results for quarter ended on 30° June, 2023 flod, with the Steck Exchanges under Regulation 38 of the Stell (Listing Obligations and Disclosure Regulationness) Regulations 2015. The full format of the unautided standarderectorisonated financial results, with detailed explanation for the quarter ended of 20° June 2013 see available on the website of the Stock Exchanges (www.beshida.com) www.reshida.com) and the Company's website (www.cere-indis.com).

 During the FY 2022-23, the Company had provided for an impairment loss of Rs. 500 Lakins on investment ende in its associate entity, Mis Milo Tile LLP and the came is declosed as an Exceptional term.
- es of the previous periods have b

Cera Sanitaryware Limited

strial Estate, Kadi 382715, District Mehsana, North Guiarat Registered Office & Works: 9, GIDC Industrial Estate, Kadi 382715, District Mehsana, North Gujarat CIN: L26910GJ1998PLC034400 Tel: (02764) 243000, 242329 E-mailt kadi@cera-india.com Website: www.cera-india.com

નાગવા લુચરવાથા (દીવ) પશ્ચિમ દેલવે – વકોદરા કિવિઝન

વિવિધ એ-જી-ચિપીંગ કાર્યો 6-3-ત નોરીસ નં DRM-BRC 073 TO 075 OF 1013-24

4	રેન્ડર વં. અને કાયનું નાય	કરમનો વ્લંદસક્રત મર્ચ (૨ માં)	જગ્ર કરાવવાની બીક સ્લિમુરીકી દિવેસીક (ર
01	DRM BRC 073 of 2023-24. When BRANT : When DRAWN SR, DEN Stages Hansthallon Bilta SSE/USFD still that this talent to-rown 12 cmg.	21.83,520.00	43,710.00
02	DRM BRC 074 of 2023-24. STBRC State :- 02 of this Sr. DEN/ South/BRC or offensite day je mounts suffered on fension W oft in Alba use	Westure Torons	S Description (S)

કરાવામાં અને રેગ્સ પોલાવાની શરીખ અને સમય <u>છે. 1 પણ પ્રયા</u>વ અને નોર્ટીસ (૧૯૬૧) અને નજ નાર્ટમાં 15:30 કરતો રેન્ડરખોલાઈ, **વેખાવારે લિવાન અને નોર્ટીસ** સત્તો **સંઈ રકાર્ટ્સ અને મોડીસનું સાનામું અર્પર્યો રેન્ડર કોર્ય પરીધી રકાર - AVANCS, પરિવારિક નો.**

સગીર ગંભીર ાને rask કરો: 🚅 facebook.com.Western Fly - સમને કોલો કરો: 💟 twitter.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 💆 🕮

ાડે ગામમાં નેહરુ ચોકડી નજીક બેફામ ગતિએ આવી રહેલા કાર ચાલકે પ્રગીરને અડકેટે લઇને કાર ભગાડી યુક્રી હતી. ઇજારસ્ત મગીરને અમદાલાદ ખસેડાયો		અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.દી.પી. વિભાગ ઈ-દેન્કદ વિભાગ નં30,31,32,33,2023-2024	G2@ U2@
હતો.	અનું	કાયનું નામ	
દહેગામમાં રહેતા અંબાલાલ પ્રજાપતિ ચોલાકળીની લારી ચલાવે છે. તેમના નાના દીકરા પુષ્કરની ઉંમર 17 વર્ષની	01	એક ટી.મી. ખાતાના ઉત્તર ઝોનમાં આવેલ જુઇ વૃદ્ધ ના નંગ મુરો સ્ટેશનોની ઇલેક્ટ્રીકલ- મીકેનીકલ તથા ઇન્ટ્યુમેન્ટ્શન ઇકલીપમે ઓપરેશન અને કોપ્પિકેન્સિવ મેઈન્ટેન્ન્સની ત્રણ વર્ષની કામગીરી	ब्ह्स सहितनी
છે. બુધવારે સવારે 7,30ના અરસામાં	0.2	क्षेत्र ही.ची. जलाता हक्षिणकोतमां आवेद चुहा चुहा १४ तंत्र	ા સુએજ લોટર

सर्कितनी ओपरेशन सबे डोम्प्रिकेलिय मेरीन्टेनन्सनी त्रश वर्षनी डामगौरी, એસ ટી.વી. ખાતાના ઉત્તર પશ્ચિમ જોત તથા દક્ષિણ પ્રથિમ જોતમાં આવેલ જ पुरा ६ वंग सुरमेत्र चेटर पंचीत्र स्टेशनकोबी प्रसिड्ट्रीडल-मीडेकीडल तथ र्धन्य्यूमेन्ट्रेशन र्धान्वीपमेन्ट्स सहितनी ओपरेशन रहने डोम्प्रिहेन्सि મેઇન્ટેનન્સની ત્રણ વર્ષની કામગીરી.

प्रांतित स्टेक्षकेनी विसेड्ट्रीडल-मीडेलीडल तथा वेन्स्ट्रुपेन्ट्रेशन वंडवीवपेन्स्

એસ ટી.પી. ખાતાના ૧26 એમ.એલ.ડી. યું .એ એસ.બી.ટાઇપ સુએજ ટ્રીટમેન્ प्तान्टनी एतिइट्रीडत-मिडेबीडत तथा राज्युमेन्ट्रेशन राडवीपमेन्यस सहितनी ओप्रदेशन छाने डोम्प्रिहेन्सिव मेरान्ट्रेनन्सनी प्रश वर्षनी डामगीरी.

खोनवार्यन हेन्डर भरपानी वारीण राजे राभव	cn. 28/08/2023 18:09 503
રેન્ડર કોક્યુપેનની દર્સ કોર્ય મેકળવાની છેલી તારીમ અને સમસ	aı. 29/08/2023 10.0> SGIŜ
हेडलीडल जीड जोववाली होटवी लहींप अने सबस	rii. 20/08/2023 17:00 SCRS



PAR DRUGS AND CHEMICALS LIMITED

CIN: L24117GJ1999PLC035512

Registered office: 815, Nilamber Triumph, Gotri Vasna Road, Vadodara-390007, Gujarat, India

Phone no.: 0265-2991021, 0265-2991022

Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

Statement of Standalone Unaudited Financial Result for the Quarter Ended 30th June, 2023

(Rs. in Lakh except per share data)

51.			Quarter Ended		Year Ended
No.	Particulars	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
	A DESCRIPTION OF THE PROPERTY	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	2294.68	2452.31	2365.98	9598.71
2	Net Profit / (Loss) for the period (before Tex. Exceptional and/or Extraordinary items ⁶)	329.74	453.94	306.56	1507.92
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional ancior Extraordinary items*)	329.74	453.94	306.56	1507.92
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items*)	246.75	344.69	229.40	1133.41
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after lax) and Other Comprehensive Income (after tax)]	246.75	344.69	229.40	1133.41
6	Equity Share Capital (Face Value per share Rs. 10/-)	1230.46	1230.46	1230.46	1230.46
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.				5893.37
8	Earnings Per Share of Rs. 10\- Each Basic as well as Diluted	2.01	2.80	1.85	9.21

Note: (a) The result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at Note: (a) The result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting held on 03/08/2023. (b) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Result for the Quarter ended 30th June, 2023 filed with the National Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended 30th June, 2023 are available on the websile by the pt/swww.nseindia.com/ and the websile of the Company at www.pard.uugs.com (c) # Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable. (d) The Company is primarily engaged in manufacturing of API, which constitute single business segment in terms of Ind AS - 108 on "Operating Segments". Accordingly, there is no separate reportable segments s per Ind AS - 108

Date: 03/08/2023

For & on Rehalf of the Board Par Drugs And Chemicals Limited

Mr. Falgun V. Savani (Chairman & Managing Director) (DIN: 00198236)

(B) Investment & Precision Cartings Ltd

Mr. Piyush I. Tamboli CHAIRMAN & MANAGING DIRECTOR

સિંધુનગર રાત્રે જાહેરમાં હારજીતની બાજી મંડાઈ હતી

સિધુનગર વિસ્તારમાં મોડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગટુ ખેલતા ૧૦ પત્તા પ્રેમી પકડાયા

સિંધુનગર, ભરતનગર, નવાપરા, રસાલા કેમ્પના જુગારીઓને લોકઅપ હવાલે કરાયા

ભાવનગર શહેરના ક્રિયુનગર વિસ્તારમાં ગત મોડી રાત્રીના સ્ટ્રીટલાઈટના અંજવાળે હારજીતની જુગારની બાજી મોડી બેસેલા સિયુનગર, ારતનગર, નવાપરા, રસાલા કેમ્પ વિસ્તારના દમ ગેમ્બલરને લોકલ કાઈમ ાવસ્તારમાં દસ ગેમ્બલટમ લાકલ ક્રાઇમ બાંચના સ્ટાફે દરોડો પાડી રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડી તમામને લોકઅપ હવાલે કરી દીધા હતા.

લાકઅપ હવાલ કરી દીધા હતા. બનાવની જાણવા મળતી વિગતો બનુસાર ભાવનગર લોકલ કાઈમ માંચના ઈન્ચાર્જ પીઆઈ શિંગરખીયા, રેરોલ ક્લી સ્ક્વોડ સ્ટાક ભાવનગર શહેર વિસ્તારમાં પેટોલીંગમાં હતાં. તે શહુર (વસ્તારમા પટ્ટાલાગમાં હતા. ત દરમ્યાન બાતમી રહે હકીકત મળી હતી કે, ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા દેવુમાતાના ચોક પાસે, સંત વાસુરામ મંદિર પાછળ ગલીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જહેર ગલીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જહેર યત મોડી રાત્રીના ૨.૩૦ કલાકના સમાટે ટેઈડ કરી તપાસ હાથ ધરત સુનાર ૨૦૩ કરો તૈયારા હાથ પરતા સાંજ કુંડાળુ વળી પૈસા ધાના વડે તિનપત્તીનો જુગાર રમી રમાડના ભરત સોરધનદાસ વલેચા (ઉ.વ.૩૮ રહે.



સર્યનગર ચોક, શકિતમાતાના મંદિર છળ, સાળીયાબીડ, ભાવનગરા, યાછળ, કાર્યાપાયાડ, ભાવપાય), રહેમતતુલ્લા રહીમભાઇ મકવાલા ઉ.વ.૩૯ રહે.૩મ નં.૧૫૭૭, બ્લોક નં.૩.એ, નવા બે માળીયા, બરતનગર,

વ.૨૭ રહે.રામજ મંદિર બાજુમાં, વ.૨૭ રહે.રામછે માંડર પાલુમાં. રસાલા કેમ્પ, નવાપરા, ભાવનગર), સંદિપ પ્રફુલભાઇ બારડ (ઉ.વ.૩૮ રહે. રૂમ નં.૩૪૧૧, બ્લોક નં.૨૧/બી, ત્રણ ળીયા ભરતનગર ભાવનગર મળી

શિવનગર, ભરતનગર, ભાવનગર),

શૈલેય ધનશ્યામભાઇ મકવાણા (ઉ.

નવી શિક્ષણ નીતિ વિશે તજજ્ઞોએ ઉપસ્થિતી રહી વિચાર વિમર્શ કર્યો

ા.ગઢકા ! બોટાદ જિલ્લા સાળા સંચાલક મંડળ દ્વારા આંકોલવાડી ગીર ખાતે "વિચાર ગોપ્દી" કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં નવી શિક્ષણ નીતિ તથા ની જરૂરિયાત અને આગામી જરૂરી

રાહેલાં માં કરાવવા જન આવાના કરવા કાર્યક્રમાં માટે વિસ્તાર પૂર્વા કે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન FRC સૌરાષ્ટ્ર ઝોન સદસ્ય અજયબાઈ પટેલ, ગીર સૌમનાથ પ્રમુખ રાજુબાઈ, બોટાઈ જિલ્લા પ્રમુખ મનોજબાઈ વિચાલી (અંદ્રાન્કેગામેડી), સહમંત્રી હિતેશભાઈ પટેલ (ગઠડા). સલાહકાર સમિતિ સભ્ય માધવ સ્વામી. આર.દી.પટેલ (ગઢડા) અને પ્રભુદાસભાઈ

ગાસડિયા તથા બોટાદ જિલ્લાના કારોબારી સભ્યો અને ૩૦ જેટલી શાળાના સંચાલકો હાજર રહ્યા હતા

આ દરમિયાન આગામી શિલ્લવનીનિ, FRC બાબતે ખુબ જ ઊંડાલપૂર્વક વાતો કરી ગુજરાત યુનિવર્સિટીમાં બોટાદ જિલ્લાનો સમાવેશ કરવા અંગે સ્પષ્ટતા જિલ્લાના સમાવેશ કરવા અગે સખટતા કરવા માટેનું આયોજન કેવી રીતે કરી શકાય તે માટેની ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. બોટા જિલ્લામાં રિક્ષણનું ત્તર રહજ પણ ઉચુ આવે તે માટે શું કેવી શકાય તે માટે બોટા જિલ્લા શાળા સંચાલકો ક્ષારા આગામી સમયમાં આગળના કાયકચોની પણ ચર્ચા કરવામાં આગળના કાયકચોની પણ ચર્ચા કરવામાં

👫 અભયમ્ અકાદમી

પોલીસ કોન્સ્ટેબલ

<u>ડેમો લેક્ચર</u> તા. 5 અને 6 ઓગસ્ટ, 2023 समय : सवारे ९ थी ११

જનરલ બેચ <u>કેમો લેક્ચર</u> તા. 5 અને 6 ઓગસ્ટ, 2023

ਸਟੀਟੀਬਵਰ + ઓનલાઇਕ એક્સેસ ● ડੇઇલી લેકચરની PDF + દરશે૪ OMR ਟੇસ્ટ

EWS / OBC / SC / ST / OBC વર્ગો માટે દિમક પરીક્ષાની કોચિંગ સફાય માટેની માન્ય સંસ્થા

મો. 7359814040 / 7623814040 ઇન્કવાયરી સમય : સવારે 9 થી 1 / સાંજે 5 થી 8 પહેલો માળ, ઓમ પ્લાઝા, રામમંત્ર મંદિરની પાછળ, ભાવનગર.

Past Transactions	Weighted Average Cost of Acquisition (in ₹)	Floor price of ₹ 54	Cap price of ₹ 57
WACA of primary issuance in last 18 months	40.00	1.35 times	1.43 times
WACA of secondary issuance in last 18 months	55.00	0.98 times	1.04 times

As certified by M's Suresh Surana & Associates LLP. Statutory Auditors, pursuant to a certificate dated July 28, 202.

- Average oos of ocquisition of Equity Shares for the Promoters and Promoter Selling Shareholders namely, SBFC Holdings Pla. Ltd. is ₹ 16.88, Arpwood Partners investmentAdvisors LLP is ₹ 12.89, Arpwood Capital Private Limited is ₹ 15.98 and Eight45 Services LLP is ₹ 12.73 and the Offer Price at the upper end of the Price Band is ₹ 57 per Equity Share. The Price/Earnings ratio based on diluted EPS for Fiscal 2023 for our Company at the upper end of the price band is 35.19 times and Price/Earningsratio of the average industry peer group as on the date of the RHP is 30.44 times. Weighted Average Return on Net Worth for Eigesla 2023. 2023 and 2021:

Year ended	RoNW (%)	Weight
As on March 31, 2023	9.93	3
As on March 31, 2022	5.18	2

Year ended	RoNW (%)	Weight
As on March 31, 2021	7.67	1
Weighted Average	7.97	

- Our market capitalisation at the lower end and higher end of price band to revenue from operations for Fiscal 2023 is 7.88 times and 8.28 times respectively.
- The three BRLMs associated with the Offer have handled 88 public issues in the past three Fiscal Years, out of which 30

Total Issues	Issues closed below IPO price on listing date
15	4
19	6
13	3
41	17
88	30
	15 19 13 41

BID/OFFER PERIOD

BID/OFFER OPEN BID/OFFER CLOSES ON MONDAY, AUGUST 7, 2023

THE EQUITY SHARES OF OUR COMPANY WILL GET LISTED ON MAIN BOARD PLATFORM OF BSE AND NSE

members of the Syndroides and by an infrastructure of the SPEAMs and at the terrolodic of the Terrological Conference of the SPEAMs and at the terrolodic of the Terrological Conference of the SPEAMs and at the terrolodic of the Terrological Conference of the SPEAMs and at the terrolodic of the Terrological Conference of the SPEAMS and at the terrological Conference of the SPEAMS and at the terrological Conference of the Terrological Conference of the SPEAMS and when Y 20,000 and up to Y (00,000 and the chims of the Non-hells does all princip has be available to relations to Non-hells does all reviews when the is set of the provised find under a charged from the up to selected in Non-hells should be invested in Non-hells should be invested in Non-hells should be interested in Non-hells should be also should be interested as a contract to which the Non-hell should be interested in Non-hell should be interested i

eachs are not permitted to particular in the Actival in season Profession Brough the ACSA process. For further details, see "Oile Procession" conjugated the GHB agreement and the Called The ACMA IN THE CASE Agreement. For further details, see "Oile Procession" conjugated the GHB agreement and the Case this and full the Case of the ACMA IN THE CASE AGREEMENT AND ACMAINS

useded to see "Helory and Certain Copposa" Addition' Engineing on page 24 of the RMP. The Mormandum of Association of our Company is a material document for importion in their ten to the CRE-End-Herderitis, see "Helderid Correlation Belorisation Belorisa

the BHP LASTING. The Equity Shares offered hough the RHP are proposed to be listed on the Stock Endanges. We have needed in cylinging approach from BSE and RSE for Equity Shares personn to letter a each order than 1,000 Exp. 1,000

isclaimer draws of 695E.

Re CLAUSE OF MSE (the Designated Stack Exchange): It is to to distinctly understood that the permissional first been claimed or approved by NSE and does it carrilly the correctness or completeness of a 450 of the RHP for the full text of the disclaimer clause of NSE.

ASBA* Simple, Safe, Smart way of Application III Limit to a specific supplying in public issues where the application amount is used to applicate the specific supplying in public issues where the application amount is used to applicate the specific supplying in the specific supplying in public issues where the application amount is used to the application of more than the specific supplying in the specific specific supplying in the specific specific

kotak

KFINTECH

KFin Technologies Limited Selenium, Tracer 8, Piol 31 & 32, Financial District, Naraktrampuda, Serlingampatly Hyderobad, Sangareddi 500 US2, Telangana, India Tal: +91 46 6716 2222 / 71981 1000; E-mail: Sofcia

COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
Jay Merry, SBFC FINANCE LIMITED
103, 1° Floor, CAB Square, Sangam Complex, Antheri Nursa Road,
Village Chahelic, Antheri (East), Mumbai 480 999 Mahansahtra, India
Tati 122 6797 5364 E-malt compliance/disorg/good com; Website

ares & France, Motial Oswal Securiles Limited; Nimeal Bong Securities PM Limited; Limited; Prabhudas Liladhar PM Ltd.; Provin Ratial Share & Stock Brokers Limited; RP es Ltd.: Systematis Shares and Stocks (India) Limited; Tama Financial Services: Trade